

ધોરણ - 3

વિદ્યાર્થી...

- યોગ્ય ઉચ્ચારણ અને આરોહ-અવરોહ સાથે કાવ્યનું પઠન વ્યક્તિગત / જૂથમાં કરે છે.
- વાર્તા કે તેનાં પાત્રો વિશે પોતાનો અભિપ્રાય / સમજ અંગ્રેજી ભાષામાં / માતૃભાષામાં મૌખિક રીતે રજૂ કરે છે.
- ટેલિફોનિક વાર્તાલાપ કે મૌખિક સંદેશાઓનો યોગ્ય પ્રત્યુત્તર આપે છે.
- ધોરણ-3 ને અનુરૂપ ગણિત, પર્યાવરણ જેવા વિષયોનાં શબ્દભંડોળનો ઉપયોગ કરે છે.
- પોતાની પસંદગી કે ના પસંદગી yes કે no દ્વારા રજૂ કરે છે.
- ટૂંકી સૂચનાઓ, વસ્તુનો રંગ-આકારની વિગત સાંભળીને તેને ઓળખી શકે છે.

ધોરણ - ૪

વિદ્યાર્થી...

- યોગ્ય હાવભાવ અને આરોહ -અવરોહ સાથે કાવ્યગાન કરે છે.
- વર્ગમાં / શાળામાં આપવામાં આવતી અંગ્રેજી ની સાદી સૂચનાઓ / જાહેરાતોનો પ્રત્યુત્તર આપે છે.
- પ્રસંગો, સ્થળ અને / અથવા તો વ્યક્તિગત અનુભવોને અંગ્રેજીમાં ટૂંકમાં વર્ણવે.
- ઉખાણાઓ અને tongue - twisters (મુશ્કેલ ઉચારવાળા શબ્દો) ની અંગ્રેજીમાં આપ લે કરે છે.
- સાદા શબ્દકોચડાઓ ઉકેલે અને શબ્દ શ્રેણી વગેરે બનાવે છે.
- Spellings અને તેનો અર્થ શોધવા શબ્દકોષ (dictionary) નો ઉપયોગ કરે છે.
- લેખનમાં વિરામચિહ્નો જેવા કે પ્રશ્નાર્થ ચિહ્ન, અલ્પવિરામ, પૂર્ણવિરામનો અને કેપિટલ લેટર્સનો યોગ્ય ઉપયોગ કરે છે.
- WH questions (who, what, where, when, How many) જેવા પ્રશ્નોના જવાબ આપી શકે છે

ધોરણ - ૫

વિદ્યાર્થી...

- દૈનિક જીવનના અનુભવો, અપરિચિત વાર્તા અને સાંભળેલા કે વાંચેલા કાવ્યો આધારિત અંગ્રેજીના પ્રશ્નો ના મૌખિક કે લેખિત સ્વરૂપે સુસંગત જવાબો આપે છે.
- અંગ્રેજીમાં Action songs, Rhymes, Stories, Game, Puzzle અને tongue - twisters (મુશ્કેલ ઉચ્ચારવાળા શબ્દસમૂહો) વગેરેનું સમૂહગાન અને આપ લે કરે છે.
- 'Hit the ball', 'Throw the ring', 'Run to the finish line' વગેરે જેવી રમતોમાં અંગ્રેજીમાં અપાયેલી સૂચનાઓ પ્રમાણે કાર્ય કરે છે.
- There is/ There are નો ઉપયોગ કરી વસ્તુઓના સ્થાનનો નિર્દેશ કરી શકે છે
- ઘટનાઓ કે પ્રસંગોના વર્ણન અને પ્રશ્નોની રચના માટે વ્યાકરણની દ્રષ્ટીએ સાચા અર્થસભર વાક્યોનો ઉપયોગ કરે છે.
- સંદર્ભ-સંકેતો (clues) માંથી સમાનાર્થી શબ્દો જેવા કે, 'big / large', 'shut / close' તેમજ વિરુદ્ધાર્થી શબ્દો જેવા કે 'inside / outside', 'light / dark' નો ઉપયોગ કરે છે.
- આજુ-બાજુના લખાણો (જેવા કે, જાહેરાતો, દિશાઓ, સ્થળોના નામ વગેરે વાંચે, સમજે અને સમસ્યાઓના જવાબ આપે છે.

ધોરણ - ૬

વિદ્યાર્થી...

- કાવ્યો, ગીતો, રમુજી ટૂંચકાઓ, ઉખાણાઓ, tongue twisters (મુશ્કેલ ઉચ્ચારવાળા શબ્દસમૂહ) વગેરેનું પઠન કરે છે.
- અંગ્રેજીનાં મૌખિક સંદેશાઓ અને ટેલિફોનિક વાતચીતના પ્રત્યુત્તર આપે અને અંગ્રેજી અથવા માતૃભાષામાં વાતચીત કરે છે.
- વર્ગખંડમાં, શાળાસભામાં, રેલ્વે - સ્ટેશન કે અન્ય જાહેરસ્થળોએ થતી જાહેરાતો અને સૂચનાઓનો પ્રત્યુત્તર આપે છે.
- નોટીસબોર્ડ, સમાચારપત્રો, ઈન્ટરનેટ, કોષ્ટકો, ચાર્ટ્સ, રેખાકૃતિ, આકૃતિઓ, નકશાઓ વગેરેમાંથી માહિતી મેળવવા વાંચન કરે છે.
- પરિચિત, અપરિચિત લખાણોના વિવિધ પ્રશ્નોના શાબ્દિક અને લેખિત પ્રત્યુત્તર આપે છે.
- વિવિધ પાઠના વાંચન દરમિયાન સંદર્ભ સંકેતો (clues) નો ઉપયોગ કરી શબ્દોના અર્થ તારવે છે અને સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દોનો યોગ્ય ઉપયોગ કરે છે.
- શબ્દના અર્થ અને Spelling તપાસવા શબ્દકોષ (dictionary) નો ઉપયોગ કરે છે.

ધોરણ - ૭

વિદ્યાર્થી...

- યોગ્ય વિરામ, આરોહ અવરોહ અને ઉચ્ચાર સાથે મોટેથી વાર્તાઓ વાંચે અને કાવ્ય પઠન કરે છે.
- શાળા અને સંગઠનો દ્વારા આયોજિત રોલ પ્લે, કાવ્ય પઠન, સ્કીટ, નાટક, ચર્ચા, ભાષણ, વક્તૃત્વ, ક્વીઝ વગેરે જેવી અંગ્રેજીની વિવિધ પ્રવૃત્તિમાં ભાગ લે છે .
- યોગ્ય શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને કુટુંબ સાથે, મિત્રો સાથે અને જુદા જુદા વ્યવસાયકારો જેવા કે, દુકાનદાર, ફેરીયાઓ વગેરે સાથે અંગ્રેજીમાં વાતચીતમાં જોડાય છે .
- રેલ્વે-સ્ટેશનમાં, બેંક, શાળાઓ વગેરે જેવા વિવિધ સંદર્ભોમાં દિશાઓ, વિનંતીઓ અને વિવિધ પ્રકારની સૂચનાઓના જવાબો મેળવે છે.
- અર્થગ્રહણ સાથે અંગ્રેજીમાં પાઠ્ય અને પાઠ્યેતર સામગ્રી વાંચે અને લખે છે.
- પાઠ્ય અને પાઠ્યેતર સામગ્રીમાં ઘટનાઓ અને વિચારોની ક્રમિકતા અને માહિતી, પાત્રો અને મુખ્ય વિચાર ઓળખે છે.
- જીવન સાથે સંબંધિત પાત્રો, પ્રસંગો, વિચારો અને વિષયવસ્તુની સરખામણી અને તફાવત કરે અને સમીક્ષા કરે છે.
- હોર્ડીન્સ (જાહેરાતનું પાટિયું) સમાચાર/ જાહેર સ્થળો પરના (સાઈન બોર્ડસ)/ નોટીસ બોર્ડની છાપેલી માહિતી જુએ અને વાંચે છે .
- સંદર્ભિત વાંચન દ્વારા અપરિચિત શબ્દોના અર્થનું અનુમાન કરે છે.

ધોરણ - ૮

અધ્યેતા..

- અંગ્રેજીમાં મહેમાનો નો પરિચય લે અને લોકોને તેના કામના સંદર્ભમાં પ્રશ્નો પૂછી મુલાકાત કરે છે.
- યોગ્ય શબ્દભંડોળનો ઉપયોગ કરી જુદા જુદા વ્યવસાયકારો જેવા કે બેંક સ્ટાફ, રેલ્વે સ્ટાફ વગેરે સાથે અંગ્રેજીમાં વાતચીત કરે છે.
- સંવાદો, કવિતાઓ, રમત ગમતની કોમેન્ટ્રી, ભાષાણો અને સમાચારોનો ટૂંકો સાર રજૂ કરે છે અને તેનાં પર પોતાના અભિપ્રાય વ્યક્ત કરે છે.
- જૂદી જૂદી પરિસ્થિતિઓ અને સંદર્ભમાં (જેમકે વિષયવસ્તુ, વિષયવસ્તુની બહારની વિગતો, જિજ્ઞાસા સભર, તેમજ યોગ્ય શબ્દ ભંડોળ અને સચોટ વાક્યો દ્વારા વાતચીત) પ્રશ્નો પૂછે છે.
- વાંચન દરમિયાન વિગતો, પાત્રો, કેંદ્રવર્તી વિચાર, વિચારો અને ઘટનાઓની ગોઠવણી જાણે છે.
- અપરિચિત શબ્દોને વાંચી સંદર્ભમાં તેના અર્થનું અનુમાન કરે છે.
- વાચન-લેખન દરમિયાન જોડણી અને અર્થ માટે શબ્દકોશનો સંદર્ભ પુસ્તક તરીકે ઉપયોગ કરે છે.
- યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ કરી શરૂઆત થી અંત સુધી અંગ્રેજીમાં સુસંગત ફકરાનું લેખન કરે છે.